

ખેડૂત જાગૃતિ કાર્યક્રમ
(હવામાનની આગાહી અને કૃષિ સલાહ)

સંખેડા તાલુકાના ગોલાગામડી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલ ભારતી તથા કૃષિ હવામાનશાસ્ત્ર વિભાગ, આકૃયુ, આણંદના સંયુક્ત ઉપક્રમે ભારત મૌસમ વિભાગ, દિલ્હી દ્વારા ચાલતી 'ગ્રામીણ કૃષિ મૌસમ સેવા' (GKMS) યોજના અંતર્ગત હવામાન આગાહી અને હવામાન આધારિત કૃષિ સલાહનું ખેડૂતો માટે મહત્વ અંગેની જાગૃતતા માટેનો કાર્યક્રમ તા:૨૨/૧૨/૨૦૧૭, શુક્રવારના રોજ યોજાયેલ. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભારત હવામાન વિભાગ (IMD), દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DDG) ડૉ. એસ. ડી. અત્રી, અતિથી વિશેષ પદે ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદના નિર્દેશક ડૉ. જે. સરકાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની શૃંઙ્ખાત કાર્યક્રમ ની શરૂઆત ડૉ. બી. એમ. મહેતા, ના સ્વાગત પ્રવચન થી થઈ હતી. ડૉ. બી. એમ. મહેતા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મંગલ ભારતી, વડોદરા- છોટાઉદેપુર ના સ્વાગત પ્રવચન થી થઈ હતી. આણંદ કૃષિ યુનીવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. અરુણ પટેલ તથા બં.અ.કૃ.મ.ના આચાર્યશ્રી અને વિદ્યાશાખાધ્યક્ષશ્રી ડૉ. કે. પી. પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ખેડૂતોને હવામાન વિભાગની કાર્ય પ્રણાલી તથા ઉપયોગીતા વિષે સવિસ્તાર માહિતી આપી હતી. કૃષિ હવામાન વિભાગ, બં.અ.કૃ.મ. આકૃયુ, આણંદના પ્રાધ્યાપક અને વડા ડૉ. એમ. એસ. કુલશ્રેષ્ઠે, વિભાગની કામગીરી તેમજ વિભાગમાં ચાલતી યોજના (GKMS) અંગેની માહિતીમાં ખેતીમાં હવામાનની આગાહી તથા તેને લગતી કૃષિ સલાહનો ઉપયોગ કરી ખેતી કાર્યોમાં જરૂરી ફેરફાર સાથે પાકમાં નુકશાનને કેવી રીતે ઘટાડી શકાય તેની ચર્ચા કરી હતી. ખેડૂતોને ખેતીમાં શક્ય બને તેટલું ઓછું પ્રદુષણ થાય તેવી ખેતી પદ્ધતિ અપનાવવા માટે સલાહ આપી. ડૉ. એસ. બી. યાદવ, નોડલ ઓફિસર, (GKMS) અને શ્રી વી. બી. વૈદ્ય, મદદનીશ પ્રાધ્યાપક, કૃષિ હવામાન વિભાગ એ અનુક્રમે 'હવામાન આગાહી અને તેને આધારિત કૃષિ સલાહની ઉપયોગીતા' તેમજ 'આબોહવા પરિવર્તન અને તેની ખેતી પાકો પર અસર' વિશે ઊંડાણમાં ખેડૂતોને માર્ગદર્શન આપેલ. ડૉ. રાજપુરા, મદદનીશ પ્રાધ્યાપક, એનિમલ સાયંસ, આકૃયુ, આણંદ એ ખેડૂતોને પશુપાલન માટે હવામાન સંબંધિત સાચવણની સલાહ આપી. શ્રી વિનય પટેલ, વૈજ્ઞાનિક, પાક સંરક્ષણ અને શ્રી મિલન બ્રહ્મભટ્ટ, વૈજ્ઞાનિક, બાગાયત, કેવીકે, મંગલભારતીએ અનુક્રમે 'હવામાન આધારિત રોગ જીવાત અને તેના નિયંત્રણ' માટે તેમજ 'બદલાતા હવામાનની બાગાયતી પાકો પર અસર' અંગે માર્ગદર્શન પૂરું પાડેલ. કાર્યક્રમનું સમાપન ડૉ. નીતિન પટેલ, મદદનીશ પ્રાધ્યાપક, (ગણિત) એ આભાર વિધિથી કરેલ.

આ પરિસંવાદનો હેતુ બદલાતી વાતાવરણીય પરિસ્થિતિમાં ટકાઉ ખેતી કરી અને સ્થાયી આવક મેળવી ખેડૂતની આર્થિક પરિસ્થિતિ સદ્ધર કરવા અંગે માહિતગાર કરવાનો હતો. આ કાર્યક્રમમાં ૩૫૦ જેટલા ખેડૂતો તથા ખેડૂત મહિલાઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ નાવ્યો હતો.



